

B.Ed. Semester - 1 (CBCS) Examination
OCT/NOV-2025 (NEW COURSE)
ACCOUNT(SELF STUDY COURSE)

Time: 1:15 Hours

Marks:35

Instructions:

1. All questions are compulsory.
2. Figures to the right indicate marks.

પ્રશ્ન-૧ નીચેના પ્રત્યેક પ્રશ્નનો ટૂંકમાં ઉત્તર આપો.

(૦૫)

- 1) હિસાબી પદ્ધતિની વ્યાખ્યા આપો.
- 2) GST નું પૂરું નામ આપો.
- 3) મૂડી એટલે શું?
- 4) કાયું સરવૈયું એટલે શું?
- 5) બેંક ઓવરડ્રાફ્ટ એટલે શું?

પ્રશ્ન-૨ નીચેના પ્રશ્નોમાંથી કોઈપણ 5 પ્રશ્નોના ઉત્તર આપો. (6 માંથી 5)

(૧૦)

- 1) હિસાબી પદ્ધતિ કલા છે કે વિજ્ઞાન?
- 2) GST ના પ્રકારોના નામ આપો.
- 3) મિલકતો એટલે શું?
- 4) આપણે કાયું સરવૈયું શા માટે તૈયાર કરીએ છીએ?
- 5) પાસબુક એટલે શું?
- 6) આપણે બેંક સિલકમેળ શા માટે તૈયાર કરીએ છીએ?

પ્રશ્ન-૩ નીચેના પ્રશ્નોમાંથી કોઈપણ 5 પ્રશ્નોના ઉત્તર આપો. (6 માંથી 5)

(૨૦)

- 1) રોકડ વ્યવહાર કે ઉધાર વ્યવહારની ઓળખ કેવી રીતે કરશો?
- 2) કોઈ પણ પાંચ કાલ્પનિક વ્યવહારો લઈ આમનોંધ લખો.
- 3) સાદી ખરીદનોંધ નમૂના સાથે સમજાવો.
- 4) સાદો રોકડમેળ નમૂના સાથે સમજાવો.
- 5) ખાસ આમનોંધ નમૂના સાથે સમજાવો.
- 6) ખાતાવાહીની ઉપયોગીતા સમજાવો..

ENGLISH VERSION

Que.1 Answer each of the following in brief. (05)

- 1) Give definition of accounting.
- 2) Give full form of GST.
- 3) What is capital?
- 4) What is trail balance?
- 5) What is bank overdraft?

Que.2 Give answer of any 5 from the following 6. (10)

- 1) Is accounting a science or an art?
- 2) Name the types of GST.
- 3) What is assets?
- 4) Why do we prepare trail balance?
- 5) What is passbook?
- 6) Why do we prepare bank reconciliation statement?

Que.3 Answer any 5 from the following 6 in detail. (20)

- 1) How will you identify cash transaction or credit transaction?
- 2) Take any five imaginary transactions and write the journal.
- 3) Explain simple purchase book with specimen.
- 4) Explain simple cash book with specimen.
- 5) Explain journal proper with specimen.
- 6) Explain utility of ledger.
